

SARDAR PATEL UNIVERSITY
BCom VI Semester Examination
Wednesday, 24 April 2013
3 – 5 pm

UB06ECOM01 – Contemporary Issues of Management Accounting

કુલ ગુણા : ૬૦

- પ્ર.૧** પી.પી. લિમિટેડની વર્ષ ૨૦૧૦ ની ૫૦% ઉત્પાદન શક્તિ એ ૫૦૦૦ એકમોના। (૧૫) ઉત્પાદન અંગેની વિગતો નીચે મુજબ છે.

<u>વિગત</u>	<u>રૂ.</u>
પ્રત્યક્ષ માલસામાન	૧૦૦૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૫૦૦૦૦
પ્રત્યક્ષ અન્ય ખર્ચ	૨૦૦૦૦
કારખાનાના પરોક્ષ ખર્ચ (૫૦% સ્થિર)	૧૦૦૦૦૦
વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ (૭૫% સ્થિર)	૪૦૦૦૦
કુલ કિંમત	૩૧૦૦૦૦

વેચાણ કિંમત એકમ દિંદ રૂ. ૭૫/-

આગામી વર્ષ ૨૦૧૧ દરમ્યાન કંપની ૫૦% ઉત્પાદન શક્તિ એ (૫૦૦૦ એકમોનું) ઉત્પાદન કરવા માંગે છે, પરંતુ નીચે મુજબ ધારણાઓ છે.

- (૧) માલસામાન અને મજૂરી ખર્ચમાં અનુકૂળે ૧૦% અને ૫% વધારો થશે.
(૨) સ્થિર ખર્ચમાં ૫% વધારો થશે.
(૩) વેચાણ કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં.

ઉપરના સંજોગોમાં કંપનીને એક વિદેશી ગ્રાહક તરફથી ઉત્પાદન શક્તિના ૪૦% (૪૦૦૦ એકમો) વધારો કરવાની એક ઓફર મળી છે. જો કંપનીના સંચાલકોને વર્ષનો કુલ નફો ૧૦૦% ઉત્પાદન શક્તિએ રૂ. ૬૩૦૦૦/- કમાવવા માંગતા હોય તો ખાસ દરખાસ્ત માટે વિદેશ ગ્રાહકને માટે એકમ દિંદ વેચાણ કિંમત કેટલી રાખવી તે દર્શાવો.

અથવા

- પ્ર.૧** રમકડાનું ઉત્પાદન કરતી કંપની રૂપલ લિમિટેડ તમને નીચેની માહિતી આપે છે. (૧૫)

<u>વિગત</u>	<u>રૂ.</u>
માલસામાન	૫૦૦૦૦૦
મજૂરી	૧૨૦૦૦૦૦
સ્થિર પરોક્ષ ખર્ચ	૬૦૦૦૦૦
ચલિત પરોક્ષ ખર્ચ (મજૂરીના ૨૫%)	૩૦૦૦૦૦
	૨૭૦૦૦૦૦

ઉત્પાદિત એકમો	૫૦૦૦૦
એકમદિન વેચાણ કિંમત	રૂ. ૫૦
વાર્ષિક ઉત્પાદન શક્તિ	૧૦૦૦૦૦

કંપનીને એક વિદેશી ગ્રાહક તરફથી વધારાના રૂપોંઠ એકમો માટે એકમ દિંદ રૂ. ૪૦/- ની કિંમત ખરીદવાની ઓફર મળી છે. એવું ધારવામાં આવે છે કે જો આ ઓફર સ્વીકારવામાં આવે તો માલસામાન ખર્ચમાં બધા ઉત્પાદનમાં એકમદિન રૂ. ૧/- ની બચત થશે. સ્થિર પરોક્ષ ખર્ચમાં

ડા. ૧૭૦૦૦૦/- નો વધારો થશે અને બધા ઉત્પાદનમાં મજૂરી ખર્ચમાં ૨% નો વધારો થશે.
કંપની ઢ્હારા આ ઓફર સ્વીકારવી જોઈએ કે નહીં? તમારા જવાબના ટેકામાં જરૂરી ગણતરીઓ
દર્શાવો.

પ્ર.૨ “જરૂરી સમયે જ” અભિગમનો અર્થ તમે શું કરો છો ? અને તેના લક્ષણોની ચર્ચા (૧૫) કરો.

અથવા

પ્ર.૨ ટૂંકનોંધ લખો (ગમે તે એક) : (૧૫)

(અ) “જરૂરી સમયે જ” અભિગમને અમલમાં મુકવા સામે અવરોધો

(બ) “જરૂરી સમયે જ” અભિગમના લાભો

પ્ર.૩ મૂલ્ય વિશ્લેષણાની વ્યાખ્યા સમજાવી તેના લક્ષણો અને મૂલ્યના પ્રકારો જણાવો. (૧૫)

અથવા

પ્ર.૩ નોંધ લખો (ગમે તે બે) : (૧૫)

(૧) મૂલ્ય વિશ્લેષણાની કાર્યવાહીના તબક્કા

(૨) મૂલ્ય વિશ્લેષણાની ટેકનિકો

(૩) સંપૂર્ણ ગુણવત્તા સંચાલન

પ્ર.૪ પર્યાવરણાલક્ષી હિસાબી પદ્ધતિ એટલે શું ? તેની ઉપયોગિતા સમજાવો. (૧૫)

અથવા

પ્ર.૪

(અ) ફેરબદલી કિંમત નક્કી કરવાની પડતર આધારિત પદ્ધતિ પર નોંધ લખો. (૦૮)

(બ) પર્યાવરણાલક્ષી હિસાબોના કાર્યક્ષેત્રની ચર્ચા કરો. (૦૭)

* * *